

# AGRICULTURE

(Gujarati Medium)

કેટેગરી

A

પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક

--	--	--	--	--	--	--	--	--	--

પરીક્ષાનો બ્લોક નંબર

--

પરીક્ષાર્થીની સહી

--

બ્લોક સુપરવાઈઝરની સહી

--

## પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ

(1)	તમને કહેવામાં ન આવે ત્યાં સુધી પ્રશ્ન પુસ્તિકા ખોલવી નહીં
(2)	પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થી પાસેથી કોઈ પણ સાહિત્ય ગાઈડ, માર્ગદર્શિકા, કાપલી, સ્લીપો, અન્ય હસ્ત લિખિત કે પ્રિન્ટેડ સાહિત્ય, મોબાઈલ ફોન, કેલક્યુલેટર, સ્પાય કેમરા, હેડ ફોન કે અન્ય વીજાણું ઉપકરણો હોવાનું જણાશે તો પરીક્ષાર્થીને ગેરલાયક ગણવામાં આવશે.
(3)	ચાલુ પરીક્ષા દરમ્યાન અંદરોઅંદર વાતચીત કરવી, અવાજ કરવો કે સુપરવાઈઝરની સૂચનાઓનું ઉલ્લંઘન કરવું તે ગેરશિસ્ત ગણાશે.
(4)	પ્રશ્નપત્ર મળે કે તરત જ ઉત્તરપત્ર (OMR SHEET) માં નિયત કરેલ જગ્યાએ પોતાનો બેઠક નંબર સ્વચ્છ અક્ષરે લખવો.
(5)	ઉત્તરપત્ર (OMR SHEET) માં નિશ્ચિત જગ્યા સિવાય પરીક્ષાર્થીએ પોતાનો બેઠક ક્રમાંક લખવો નહીં તથા પોતાની આગવી ઓળખ છતી થાય તેવી નામ સહિતની અન્ય કોઈ પણ પ્રકારની નિશાની કરવાની સખ્ત મનાઈ છે. તેમ છતાં પણ કોઈ પણ નિશાની કે ઓળખ માલૂમ પડશે તો તેને સંપૂર્ણ ગેરશિસ્ત ગણવામાં આવશે અને પરીક્ષા માટે ગેરલાયક ગણવામાં આવશે.
(6)	ઉત્તરપત્ર (OMR SHEET) ના પ્રમાણપત્રમાં પરીક્ષાર્થી તથા સુપરવાઈઝર બંનેની સહી ફરજિયાત છે. બંનેની સહી વિનાના ઉત્તરપત્ર (OMR SHEET) નું મુલ્યાંકન થશે નહીં. જેથી ઉમેદવારે સુપરવાઈઝરશ્રીની સહી અવશ્ય મેળવી લેવી.
(7)	પરીક્ષાર્થીએ બ્લ્યુ/બ્લેક બોલપોઈન્ટ પેનનો ઉપયોગ કરી શકાશે. અન્ય શાહી કે પેન કે પેન્સિલ તથા સફેદ શાહીનો ઉપયોગ કરી શકશે નહીં.
(8)	પ્રશ્નપત્રમાં આપેલ વિકલ્પોમાં કોઈપણ પ્રકારની નિશાની કરવી નહીં.
(9)	આ કસોટી પત્રમાં કુલ -200 પ્રશ્નો છે. પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર A, B, C અને D પૈકી કોઈ એક છે. દરેક પ્રશ્ન માટે ચાર વિકલ્પો આપવામાં આવેલ છે. તમારે બધા જ પ્રશ્નોના ઉત્તર આપવાના છે. ઉદાહરણ તરીકે : ગુજરાતનું પાટનગર કયું છે ? (A) અમદાવાદ (B) ગાંધીનગર (C) વડનગર (D) પાટણ અહીં જવાબ (B) ગાંધીનગર જવાબ સાચો હોય, OMR SHEET માં વિકલ્પ (B) નું વર્તુળ ઘૂંટવાનું (Encode) કરવાનું થાય. A ● C D
(10)	પ્રત્યેક સાચા જવાબદીઠ 1 (એક) ગુણ મળવાપત્ર થશે. પ્રત્યેક ખોટા ઉત્તર માટે 0.25 ગુણ કપાશે (નેગેટીવ 0.25) જો ઉમેદવાર કોઈ પ્રશ્નનો ઉત્તર આપવા માંગતા ન હોય તો વિકલ્પ E પસંદ કરવાનો રહેશે. વિકલ્પ E માટે નેગેટીવ ગુણ રહેશે નહીં.
(11)	છેકછાકવાળા જવાબ તથા એકથી વધારે વિકલ્પમાં આપેલ જવાબ તથા બ્લેડ કે રબ્બર કે વાઈટનર (સફેદ શાહી) નો ઉપયોગ કરી બદલાવેલ જવાબ માટે 0.25 નેગેટીવ ગુણ મળશે.
(12)	પરીક્ષા પૂરી થયા બાદ ઉત્તરપત્ર (OMR SHEET) બ્લોક સુપરવાઈઝરને પરત કર્યા બાદ વર્ગખંડ છોડવાનો રહેશે. તેમ કરવામાં કસૂર થયેથી શિસ્ત ભંગના પગલાં ગણી પરીક્ષા માટે જે તે ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે.
(13)	આ પરીક્ષાનો સમય 180 મિનિટનો છે.
(14)	સૌથી યોગ્ય વિકલ્પ જવાબ તરીકે ધ્યાને લેવાશે.

રફ કામ માટેનું પેઈજ

- (1) 'સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની જોગવાઈ ભારતના સંવિધાનની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે ?'
- (A) 51. ક (ક) (B) 51. ક (છ) (C) 51. ક (ડ) (D) 51. ક (ગ)
- (2) ભારતીય સંવિધાનના ભાગ-4માં 'રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો' ની જોગવાઈ કઈ કલમથી ક્યાં સુધીની કલમમાં કરવામાં આવેલ છે ?
- (A) 36 થી 45 (B) 35 થી 48 (C) 34 થી 50 (D) 36 થી 51
- (3) દરિયાના જળનું ઘનત્વ (Density) વધતું જાય છે, તેમ તેમ.....
- (A) ઉંડાણ અને ખારાશ ઘટે છે. (B) ઉંડાણ વધે છે અને ખારાશ ઘટે છે.  
(C) ઉંડાણ ઘટે છે અને ખારાશ વધે છે. (D) ઉંડાણ અને ખારાશ વધે છે.
- (4) ભારતની પ્રાચીનતમ ક્રુટબોલ ટૂર્નામેન્ટ કઈ છે ?
- (A) સંતોષ ટ્રાફી (B) ડૂરંડ કપ  
(C) રોવર્સ કપ (D) આઈ. એફ. એ. શીલ્ડ
- (5) હડપ્પા સંસ્કૃતિના પ્રમુખ સ્થળ 'લોથલ'ની શોધ કોણે કરી હતી ?
- (A) વી. ડી. શર્મા (B) યજ્ઞદત્ત શર્મા  
(C) એસ. આર. રાવ (D) પ્રો. સુરજભાન
- (6) વધારે મેહસુલ પ્રાપ્તિ માટે કરવેરા ઉઘરાવવાના સંદર્ભમાં વિકાસના હેતુથી કયા કાળને પ્રમુખ માનવામાં આવે છે ?
- (A) મોર્યકાળ (B) ઉત્તર વૈદિકકાળ  
(C) ગુપ્તકાળ (D) છઠ્ઠી શતાબ્દિ ઈસ્વી. પૂર્વ
- (7) પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે લંબાવેલી મુદત, શાળાના શૈક્ષણિક વર્ષ શરૂ થયાથી કેટલા મહિના સુધીની રહેશે ?
- (A) 5 મહિના (B) 3 મહિના (C) 9 મહિના (D) 6 મહિના
- (8) રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 માં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકનો રેશિયો કેટલો નિર્ધારિત કરેલ છે ?
- (A) 30:1 (B) 35:1 (C) 25:1 (D) 20:1
- (9) રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020માં નેશનલ ક્યુરીક્યુલમ ફેમવર્કને કેટલા વર્ષમાં રીવાઈઝ્ડ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવેલ છે ?
- (A) પાંચ વર્ષ (B) ત્રણ વર્ષ (C) આઠ વર્ષ (D) પ્રતિવર્ષ
- (10) 'જ્યાં સુધી માતૃભાષા (ગુજરાતી)ને હું ઉચ્ચ સ્થાન પર નહીં મૂકું ત્યાં સુધી હું પાઘડી નહીં બાંધું' એવું કોણે કહ્યું હતું ?
- (A) કવિ પ્રેમાનંદ (B) કવિ નર્મદ (C) કવિ કલાપી (D) કવિ સુન્દરમ્
- (11) 'વિશ્વ વસતી દિન' ક્યારે ઉજવવામાં આવે છે ?
- (A) 11 ઓગસ્ટ (B) 11 ઓક્ટોબર (C) 11 જૂન (D) 11 જુલાઈ
- (12) આગામી ઓલીમ્પીક કઈ જગ્યાએ યોજનાર છે ?
- (A) જાપાન (ટોક્યો) (B) ચીન (શાંઘાઈ)  
(C) ફ્રાન્સ (પેરીસ) (D) ઈંગ્લેન્ડ (લંડન)

- (13) નવી ખાનગી માધ્યમિક શાળાની મંજૂરી કોણ આપે છે ?  
 (A) જિલ્લાશિક્ષણાધિકારી (B) નિયામક, શાળાઓની કચેરી  
 (C) શિક્ષણ સચિવ - શિક્ષણ વિભાગ (D) ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ
- (14) ‘મારે ટોડલે બેઠો રે મોર’ ગીતને કોણે ચિરસ્મરણીય કર્યું ?  
 (A) દમયંતી બરડાઈ (B) મીનાબેન પટેલ  
 (C) દિવાળીબેન ભીલ (D) ગીતાબેન રબારી
- (15) ભારતનું કયું નગર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે ?  
 (A) દિલ્લી (B) મુંબઈ (C) કલકત્તા (D) બેંગલુરુ
- (16) હાલમાં ગુજરાતમાં વર્લ્ડ બેંકના વડા તેમજ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ નીચે પૈકી કઈ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી હતી ?  
 (A) જી.સી.ઈ.આર.ટી. (B) વિદ્યા સમીક્ષા કેન્દ્ર  
 (C) ગુજરાત યુનિવર્સિટી (D) આયુર્વેદ યુનિવર્સિટી
- (17) દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કેવી રીતે થઈ શકે ?  
 (A) કોલેજ ગ્રંથાલયમાં છપાયેલી અધ્યયન સામગ્રી દ્વારા  
 (B) જ્યાં રહેતા હોય ત્યાં માધ્યમો દ્વારા તથા છપાયેલી અધ્યયન સામગ્રી દ્વારા  
 (C) કોલેજમાં અધ્યયનની વિવિધ પદ્ધતિઓ દ્વારા  
 (D) કોલેજમાં હાજરી આપ્યા સિવાય સ્વપ્રયત્નો દ્વારા
- (18) ‘શિક્ષણમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન’ પુસ્તકના લેખક કોણ છે ?  
 (A) પ્રો. યશપાલ (B) ડૉ. ગુણવંત શાહ  
 (C) પ્રો. મર્મર મુખોપાધ્યાય (D) ડૉ. ભદ્રાયુ વચ્છરાજાની
- (19) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘વિદ્યાંજલિ’ યોજના શાના માટે છે ?  
 (A) વાંચન વિકસાવવા માટેની યોજના  
 (B) શાળા પુસ્તકાલય સમૃદ્ધ બનાવવા પુસ્તક દાન માટેની યોજના  
 (C) શાળાની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયામાં રસ ધરાવતાં સમાજના વ્યક્તિઓ માટે શિક્ષણ દાન માટેની યોજના  
 (D) નબળા બાળકોને દત્તક લઈ સઘન શિક્ષણ આપવાની યોજના
- (20) 21 મી સદીના પડકારોને પહોંચી વળવા માટે ડેલોર્સ રિપોર્ટ Learning The Treasure within માં શિક્ષણના કયા બે સ્તંભનો ઉલ્લેખ કર્યો છે ?  
 (i) ટકાઉ વિકાસ પ્રાપ્ત કરતાં શીખવું.  
 (ii) શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ સિદ્ધ કરતાં શીખવું.  
 (iii) શીખતાં શીખવું  
 (iv) સહજીવન શીખવું  
 (A) i, ii (B) i, iii (C) iii, iv (D) ii, iii
- (21) કયું લક્ષણ અવૈધિક શિક્ષણનું છે ?  
 (A) પરીક્ષા અને સર્ટિફિકેટનું મહત્ત્વ (B) શીખવનારની ઉચ્ચ લાયકાત  
 (C) બાળકમાં જીવન-કૌશલ્યોનો વિકાસ કરવાનો ઉદ્દેશ (D) સાક્ષરતા કરતાં આજીવિકાલક્ષી શિક્ષણ પર ભાર

- (22) વર્ગ-શિક્ષણ દરમિયાન આદર્શવાદી શિક્ષક નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ નહીં કરે ?  
 (A) આગમન (B) ચર્ચા-સંવાદ (C) પ્રશ્નોત્તરી (D) પ્રવચન
- (23) ગાંધીજીએ આપેલી શિક્ષણની વ્યાખ્યામાં શિક્ષણનું કયું ધ્યેય પ્રગટ થાય છે ?  
 (A) વ્યક્તિલક્ષી (B) સામાજિક (C) વિશિષ્ટ (D) આધ્યાત્મિક
- (24) “બાળક એ કંઈ પ્રૌઢની લઘુ આવૃત્તિ નથી.” - આ ગૃહીત/ધારણા કોણે રજૂ કરી ?  
 (A) ડ્યૂઈ (B) રૂસો (C) પ્લેટો (D) સોક્રેટીસ
- (25) શિક્ષણના ત્રણ ‘વાદ’ અને તેમાં સ્વીકૃત થયેલા વિદ્યાર્થીના સ્વરૂપ અંગેના ખ્યાલોને યોગ્ય રીતે જોડો :  
 1. આદર્શવાદ અ. સામાજિક સ્વરૂપ  
 2. પ્રકૃતિવાદ બ. આત્મિક સ્વરૂપ  
 3. વ્યવહારવાદ ક. શારીરિક સ્વરૂપ  
 સાચો વિકલ્પ પસંદ કરો.  
 (A) 1-બ, 2-અ, 3-ક, (B) 1-અ, 2-ક, 3-બ,  
 (C) 1-ક, 2-બ, 3-અ, (D) 2-બ, 2-ક, 3-અ,
- (26) “વાસ્તવના સ્વરૂપનું તાર્કિક અન્વેષણ એ તત્ત્વજ્ઞાન છે.” - આ વ્યાખ્યા કોણે આપી છે ?  
 (A) ડૉ. રાધાકૃષ્ણાન્ (B) મહર્ષિ અરવિંદ  
 (C) રવિન્દ્રનાથ ટાગોર (D) જે. કૃષ્ણમૂર્તિ
- (27) નીચેનામાંથી કઈ પ્રક્રિયા - સાચી રીતે આગળ વધે છે ?  
 (A) તત્ત્વજ્ઞાન - શિક્ષણ ઉદ્દેશો - પાઠ્યક્રમ - અભ્યાસક્રમ  
 (B) તત્ત્વજ્ઞાન - શિક્ષણ ઉદ્દેશો - અભ્યાસક્રમ - પાઠ્યક્રમ  
 (C) શિક્ષણ ઉદ્દેશો - તત્ત્વજ્ઞાન - અભ્યાસક્રમ - પાઠ્યક્રમ  
 (D) પાઠ્યક્રમ - અભ્યાસક્રમ - તત્ત્વજ્ઞાન - શિક્ષણ ઉદ્દેશો
- (28) “વિદ્યાર્થીમાં રહેલા સદ્અંશો, સદ્વૃત્તિઓ અને સુરુચિઓ જાગૃત કરવાનું, વિકસાવવાનું અને યોગ્ય માર્ગે વાળવાનું કામ કેળવણીનું છે ?” - આ વિચાર કોણે આપ્યો ?  
 (A) વિનોબાજી (B) નાનાભાઈ ભટ્ટ  
 (C) ગાંધીજી (D) શ્રી અરવિંદ
- (29) શિક્ષણની કઈ વિચારધારામાં વસ્તુ કરતાં વિચારને વધુ મહત્ત્વ આપવામાં આવે છે ?  
 (A) પ્રકૃતિવાદ (B) આદર્શવાદ  
 (C) વ્યવહારવાદ (D) અસ્તિત્વવાદ
- (30) વ્યવહારવાદ અનુસાર શિક્ષણ આપવાના હેતુઓ સંદર્ભે કયો હેતુ યોગ્ય નથી ?  
 (A) બાળક અનુભવ મળતા જ નવા પ્રકારના જ્ઞાનનું સર્જન કરે છે.  
 (B) બાળકમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવો જોઈએ.  
 (C) બાળકનો આધ્યાત્મિક વિકાસ કરવો જોઈએ.  
 (D) બાળકને સમસ્યા ઉકેલ રીતથી વાકેફ કરવો જોઈએ.


- (31) સમગ્ર જીવનની અગીયાર અવસ્થાઓ પૈકી નીચે આપેલી અવસ્થાઓને ક્રમાનુસાર ગોઠવો.  
 (A) બાલ્યાવસ્થા  
 (B) વૃદ્ધાવસ્થા  
 (C) પ્રારંભિક પુખ્તાવસ્થા  
 (D) મધ્યવય  
 (E) પ્રારંભિક બાલ્યાવસ્થા  
 (A) E, A, B, C, D (B) A, E, C, D, B (C) A, E, D, C, B (D) A, E, B, C, D
- (32) અધ્યાપન મનોવિજ્ઞાન .....
- (A) વાતાવરણની દેન છે.  
 (B) વારસો અને વાતાવરણની વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે.  
 (C) વારસાનું અસરનું પરિણામ છે.  
 (D) જે મનોવિજ્ઞાનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા અધ્યયનની પ્રક્રિયાની સુધારણા માટે સિદ્ધાંતો અને નિયમો આપે છે.
- (33) અહં - આદર્શની રચના એ કઈ અવસ્થા દરમિયાન વ્યક્તિત્વ વિકાસનું લક્ષણ છે ?  
 (A) તુરુણાવસ્થા (B) પ્રારંભિક બાલ્યાવસ્થા (C) ઉત્તર - બાલ્યાવસ્થા (D) વૃદ્ધાવસ્થા
- (34) સિદ્ધાંતો અને તેના જનકનાં સાચાં જોડકાં બનાવો.  
 1) બહુ અવયવ સિદ્ધાંત a) ગોલમેન  
 2) સાંવેગિક બુદ્ધિ સિદ્ધાંત b) સ્ટર્નબર્ગ  
 3) બહુવિધબુદ્ધિ સિદ્ધાંત c) થર્સ્ટન  
 4) ત્રિ-સ્વરૂપિય બુદ્ધિસિદ્ધાંત d) ગાર્ડનર  
 (A) 1) c, 2) a, 3) d, 4) b (B) 1) a, 2) c, 3) b, 4) d  
 (C) 1) d, 2) c, 3) b, 4) a (D) 1) a, 2) b, 3) d, 4) c
- (35) શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા શિક્ષક...
- 1) વિદ્યાર્થીની કક્ષાને અનુરૂપ અધ્યાપનની તૈયારી કરે છે.  
 2) યોગ્ય ઝડપે આગળ વધે છે.  
 3) શિક્ષક દ્વારા રજૂ થતું વિષયવસ્તુ વિદ્યાર્થીની ક્ષમતાને અનુરૂપ હોય છે.  
 (A) (1) અને (2) સાચાં છે. (B) (2) અને (3) સાચાં છે.  
 (C) (1), (2) અને (3) સાચાં છે. (D) (1) અને (3) સાચાં છે.
- (36) અધ્યયનના નિયમો (Laws of Learning) સંદર્ભે નીચે પૈકી કયો નિયમ લાગુ પડતો નથી ?  
 (A) અસરનો નિયમ (B) પુનરાવર્તનનો નિયમ (C) ભૂલનો નિયમ (D) તત્પરતાનો નિયમ
- (37) કઈ અધ્યયન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ 'કઈ રીતે શીખવું' તે શીખે છે ?  
 (A) પ્રયત્ન અને ભૂલ (B) કારક અભિસંધાન  
 (C) ઈરણ ઘટાડાનો સિદ્ધાંત (D) અન્વેષણાત્મક અધ્યયન
- (38) 'પોતાના દોષો બીજામાં જોવાનો પ્રયત્ન કરવો.' - આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?  
 (A) પ્રક્ષેપણ (B) દમન (C) સ્થગિતતા (D) પ્રાયશ્ચિત

- (39) એરિક એરિકશનના મતે વ્યક્તિત્વ પર અસર કરતાં પરિબળો પૈકી નીચેનામાંથી કયું લાગુ પડતું નથી ?  
 (A) અહમ્ (B) સામાજિકતા (C) સંસ્કૃતિ (D) આનુવંશિકતા
- (40) નીચેના પૈકી કઈ બાબત શાસ્ત્રીય અભિસંધાન માટે લાગુ પડતી નથી ?  
 (A) પાવલોવે કૂતરા પર પ્રયોગો કરી આ અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો.  
 (B) આ અભિસંધાનમાં ઉદ્દીપક હોવો જરૂરી છે.  
 (C) આ અનુસંધાન R પ્રકારનું અભિસંધાન પણ કહેવાય છે.  
 (D) મુખ્ય ઉદ્દીપક સાથે ગૌણ ઉદ્દીપક મૂકવામાં આવે છે.
- (41) વ્યક્તિને કોઈ વસ્તુ, અન્ય વ્યક્તિ કે પ્રવૃત્તિ પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરતી શક્તિ એટલે શું ?  
 (A) પ્રેરણા (B) બુદ્ધિ  
 (C) રસ (અભિરુચિ) (D) અભિયોગ્યતા
- (42) અધ્યયન પ્રક્રિયાની સમજ પ્રયોગો દ્વારા આપનારમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?  
 (A) પાવલોવ (B) સ્કીનર (C) સ્ટ્રોંગ (D) થોર્નડાઈક
- (43) ગણિતમાં નિષ્ફળ જનાર વ્યક્તિ જ્યારે ચિત્રકામમાં પ્રાવીણ્ય મેળવીને સિદ્ધિ હાંસલ કરે તો તેને કઈ બચાવપ્રયુક્તિ કહેવાય ?  
 (A) યૌક્તિકીકરણ (B) પ્રક્ષેપણ  
 (C) ઊર્ધ્વીકરણ (D) ક્ષતિપૂર્તિ
- (44) મેદ પ્રધાન અને સ્નાયુ પ્રધાન એવા વ્યક્તિત્વના પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે રજૂ કર્યા છે ?  
 (A) શેલ્ડન (B) ટર્મેન (C) યુંગ (D) કેશમર
- (45) 1927માં પાંચ વિભાગમાં તૈયાર થયેલ રસસંશોધનિકાના રચયિતા મનોવૈજ્ઞાનિક કોણ હતા ?  
 (A) કુડર (B) થર્સ્ટન (C) સ્ટ્રોંગ (D) ગીલફર્ડ
- (46) ગુજરાતમાં 1960 માં યાંત્રિક અભિયોગ્યતા કસોટી કોણે પ્રમાણિત કરી હતી ?  
 (A) ડૉ. કે.જી. દેસાઈ (B) ડૉ. જે. સી. પરીખ  
 (C) પ્રો. ટી. પી. લેલે (D) ડૉ. આર. બી. નાયક
- (47) બેન્જમિન બ્લૂમે રજૂ કરેલ મૂલ્યાંકન ત્રિકોણમાં કઈ બાબત સમાવિષ્ટ નથી ?  
 (A) સાહિત્ય નિર્માણ (B) અધ્યાપન અનુભવો  
 (C) શિક્ષણના હેતુઓ (D) મૂલ્યાંકન
- (48) નીચેના પૈકી કયું ક્રિયાત્મક કસોટીનું લક્ષણ છે ?  
 (A) બોલ્યા વગર જવાબ આપી શકાય નહિ.  
 (B) મૂલ્યાંકન સામૂહિક રીતે હાથ ધરી શકાય.  
 (C) જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યોનું માપન થઈ શકે છે.  
 (D) અનૌપચારિક રીતે હાથ ધરાય છે.
- (49)  $Z = 3M - \bar{X}$  આ સૂત્ર દ્વારા શું શોધી શકાય છે ?  
 (A) મધ્યક (B) વિચલન (C) મધ્યસ્થ (D) બહુલક

- (50) આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ નીચેમાંથી કઈ માહિતી એ પ્રાથમિક માહિતી નથી.
- (A) સંશોધક દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે એકઠી કરાયેલ હોય તેવી માહિતી.  
 (B) નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન દ્વારા એકત્રિત કરાયેલ હોય તેવી ભારતની વસ્તી ગણતરીની માહિતી.  
 (C) ભારતના રજિસ્ટ્રાર ઓફિસ, ન્યુ દિલ્લી દ્વારા મૃત્યુદર અને જન્મદરને લગતી પ્રકાશિત માહિતી.  
 (D) ભારતની વસ્તી ગણતરીની માહતી જે U.N. Statistical Abstract માં પ્રકાશિત કરવામાં આવેલ હોય.
- (51) એક વર્ગખંડમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે.
1. શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ સાતત્યપૂર્ણ રીતે વિવિધ ઊદાહરણો રજૂ કરે છે.
  2. શિક્ષક વિદ્યાર્થીઓને પોતાના દ્વારા રજૂ થયેલ ઊદાહરણો પરથી સામાન્ય સિદ્ધાંત તારવવાનું કહે છે.
- ઉપરોક્ત બે પ્રવૃત્તિઓને જોતા આપને શિક્ષણના કયા અભિગમનો ઉપયોગ થયેલ જોવા મળે છે.
- (A) આગમન અભિગમ (B) નિગમન અભિગમ  
 (C) સમસ્યા ઊકેલ અભિગમ (D) પૂછપરછ અભિગમ
- (52) શિક્ષણમાં વિવિધ અભ્યાસક્રમો ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં ઉપયોગમાં આવતું પ્લેટફોર્મ DIKSHA એટલે ...
- (A) Digital Infrastructure for Knowledge Sharing (B) Digital Initiative for Knowledge Sharing  
 (C) Digital Interactive for Knowledge Sharing (D) Digital Interface for Knowledge Sharing
- (53) ધોરણ - 11 અને ધોરણ - 12 ના NCERT આધારિત અભ્યાસક્રમ માટે SWAYAM MOOCS ના જુદાં જુદાં ઓનલાઈન કોર્સનું નિર્માણ થયેલ છે. MOOC ને નીચેનામાંથી કયા નામથી ઓળખવામાં આવે છે ?
- (A) Module open online courses (B) Massive open online courses  
 (C) Mathematics open online courses (D) Management open online courses
- (54) બ્લુમ ટેક્સોનોમીના મુખ્ય ત્રણ સૂત્રોમાં નીચેનામાંથી કયા મુખ્યક્ષેત્રનો સમાવેશ થતો નથી ?
- (A) જ્ઞાનાત્મક (Cognitive) (B) ભાવાત્મક (Affective)  
 (C) ક્રિયાત્મક (Psychomotor) (D) અનુભવાત્મક (Experiential)
- (55) રચનાત્મક મૂલ્યાંકનના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું નથી.
- (A) રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એકભાગ છે.  
 (B) રચનાત્મક મૂલ્યાંકન શિખવાની પ્રક્રિયા પર ભાર મૂકે છે.  
 (C) રચનાત્મક મૂલ્યાંકન માટે અવલોકન, પ્રશ્નોત્તરી, વર્કસીટ, પ્રોજેક્ટ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.  
 (D) રચનાત્મક મૂલ્યાંકન નિર્ધારિત પાઠ્યક્રમને ઉપયોગ કરીને ઔપચારિક રીતે કરવામાં આવે છે.
- (56) પાંચ લાકડી A, B, C, D અને S છે. A, B થી નાની પણ S થી લાંબી છે. C તેમાં સૌથી લાંબી છે. D, B થી થોડી નાની અને A થી થોડી મોટી છે. લાકડીને લંબાઈના ઉતરતા ક્રમમાં ગોઠવતાં ચોથા ક્રમે કઈ લાકડી આવશે ?
- (A) A (B) B (C) S (D) D
- (57) P, Q, R, S, T, V, W અને Z કેન્દ્ર તરફ મોં રાખીને ગોળાકાર ટેબલની આજુબાજુ બેઠા છે. દરેક ઉપરના ક્રમમાં બેઠા નથી. S, P ની જમણે ત્રીજા સ્થાને છે. P, V ની જમણે બીજા સ્થાને છે. R, V ની ડાબી બાજુ બીજા સ્થાને અને Q ની જમણે ત્રીજા સ્થાને છે. W, V ની સામે બેઠો છે. Z, T ની જમણે બીજા સ્થાને છે. તો T ની ડાબે પ્રથમ સ્થાને કોણ બેઠું છે ?
- (A) V (B) R (C) P (D) Q



(58) નીચેની આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે ?



- (A) 12 (B) 10 (C) 14 (D) 16

(59) વ્યક્તિ A પૂર્વ દિશામાં 6 મીટર ચાલે છે ત્યાંથી ઉત્તર દિશામાં 8 મીટર ચાલે છે. ત્યાંથી નૈઋત્ય દિશામાં 12 મીટર ચાલે છે તો વ્યક્તિ મૂળબિંદુથી કેટલો દૂર હશે ?

- (A) 10 મીટર (B) 2 મીટર (C) 26 મીટર (D) 4 મીટર

(60) શ્રેણી પૂર્ણ કરો.

4, 8, 9, 27, 16, 64, 25 .....?.....

- (A) 101 (B) 98 (C) 100 (D) 125

(61) આપેલ શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરોનાં ક્રમ પ્રમાણે ગોઠવો.

(1) TEACHER

(2) TRAINEE

(3) TUTION

(4) TUTORIAL

(5) TRAILER

- (A) 1, 2, 5, 3, 4 (B) 1, 5, 2, 4, 3 (C) 1, 5, 2, 3, 4 (D) 1, 2, 5, 4, 3

(62) નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો.


1, 2, 10, 37, .....?.....

- (A) 61 (B) 47 (C) 64 (D) 101

(63) આજે સોમવાર છે. 62 દિવસ પછી કયો વાર આવશે ?





- (A) શનિવાર (B) રવિવાર (C) મંગળવાર (D) બુધવાર

(64) આકૃતિમાં કેટલા ત્રિકોણ છે ?



- (A) 21 (B) 24 (C) 27 (D) 28

- (65) એક વ્યક્તિ પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તે  $90^{\circ}$  ના ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. ફરી પાછો ઘડિયાળના કાંટાની દિશામાં  $45^{\circ}$  ફરે છે. ત્યાંથી પાછો ઘડિયાળના કાંટાની દિશામાં  $180^{\circ}$  ફરે છે. ત્યાર બાદ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં  $270^{\circ}$  ફરે છે. તો હવે તે કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે ?
- (A) ઉત્તર - પશ્ચિમ (B) પશ્ચિમ - દક્ષિણ  
(C) દક્ષિણ - પૂર્વ (D) ઉત્તર - પૂર્વ
- (66) ફૂલ : પાંદડી  
નીચેના પૈકી યોગ્ય જૂથ શોધો જે ઉપરના જૂથને રજૂ કરે.
- (A) બોલ : બેટ (B) ટાયર : સાઈકલ  
(C) પેન્સીલ : નોટ (D) આખડિયો : વેલણ
- (67) રાજેશ ખૂબ મોટા મોલમાંથી કેટલીક વસ્તુ ખરીદીને તેનું પેમેન્ટ પોતાના ડેબીટ કાર્ડથી કરે છે. મોલની સામે આવેલ મેટ્રો સ્ટેશનથી તે મેટ્રો ટ્રેન પકડી પોતાના ઘરે પહોંચે છે તો રાજેશ ક્યાં રહેતો હશે ?
- (A) સુરત (B) પુરી  
(C) હૈદરાબાદ (D) જોધપુર
- (68) (i) છેલ્લાં બે વર્ષથી જિલ્લાનો સાક્ષરતા દર વધે છે.  
(ii) જિલ્લા પ્રસાસને છેલ્લાં કેટલાક સમયથી સાક્ષરતા ઝુંબેશ સાથે સંકળાયેલ વ્યક્તિઓની સઘન તાલીમ કરેલ છે અને તેમના કાર્યનું નિરીક્ષણ કરવામાં આવે છે.
- (A) વિધાન (i) એ કારણ છે અને વિધાન (ii) એ અસર છે.  
(B) વિધાન (i) અને વિધાન (ii) એ બન્ને સ્વતંત્ર અસર છે.  
(C) વિધાન (ii) કારણ છે અને વિધાન (i) એ અસર છે.  
(D) વિધાન (i) અને (ii) બન્ને કારણ છે.
- (69) મહેશનું મોઢું પૂર્વદિશામાં છે તે હવે  $180^{\circ}$  કલોક વાઈઝ ફરે છે ત્યાર બાદ  $90^{\circ}$  એન્ટી કલોક વાઈઝ ફરે છે. તો હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ?
- (A) પૂર્વ (B) દક્ષિણ  
(C) ઉત્તર (D) પશ્ચિમ
- (70) નીચે પૈકી કયો વેન ડાયાગ્રામ વિશ્વ, એશિયા, ભારત અને ગુજરાતને દર્શાવે છે.



- (71) 'परिरंभ' शब्दનો સમાનાર્થી શબ્દ શું થાય ?  
 (A) તેજ (B) બનાવટ (C) આલિંગન (D) લુચ્ચું
- (72) શુદ્ધ શબ્દ કયો છે ?  
 (A) મબલખ (B) શૃંગાર (C) ઔદ્યોગીકરણ (D) પ્રિયવંદા
- (73) 'એ પરીક્ષા : નિમિષ નહિ ચક્ષ, વિરજ વસ્ત્ર, ઊભા અંતરિક્ષ' - પંક્તિમાં રેખાંકિત કરેલ શબ્દ 'વિરજ'નો અર્થ શું થાય છે ?  
 (A) મુલાયમ (B) રેશમી (C) રંગીન (D) સ્વચ્છ
- (74) આપેલાં વાક્યોમાં 'વિધ્યર્થ વાક્ય' કયું છે ?  
 (A) ભગવાન ભજયા હોત તો ખોટું કાર્ય ન કરત. (B) આટલું મારું માનશો તો સો વર્ષ જીવશો.  
 (C) પહેરજે, શર્ટ ફાડી નાખતો નહીં. (D) ભાઈ, કર્યા ભોગવવાં છે !
- (75) શબ્દ અને તેના અનેકાર્થી શબ્દોની ખોટી જોડ હોય તેવો વિકલ્પ કયો છે ?  
 (A) મકરંદ - ભમરો, કોકિલ (B) કોઠો - મન, અંતઃકરણ  
 (C) અર્ક - કિરણ, આકડો (D) પટ - ઢાંકણ, ગડી
- (76) 'પગ મૂકી શકાય નહીં એવું' ? - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો છે ?  
 (A) અગોચર (B) અચિંત્ય (C) અચર (D) અછડતું
- (77) પદ્ધત્તમ યોગ્ય રીતે સચવાયો હોય તેવું વાક્ય કયું છે ?  
 (A) ગામમાં એક અનાજ વેચતો ફેરિયો દેખાયો.  
 (B) મેં આજે ચામડાની, એક, નાનકડી બેગ ખરીદી  
 (C) વ્યાયામવીરો રોજ સવારે ઝડપથી મેદાનમાં દોડતા હોય છે.  
 (D) રોજ સવારે માળી બગીચામાં ઝાડને પાણી પાય છે.
- (78) નીચે આપેલાં વાક્યોમાં 'અધિકરણ વિભક્તિ'નો પ્રયોગ થયો હોય તેવું વાક્ય કયું છે ?  
 (A) તે કાલે રાત્રે ગયો. (B) કૂતરી તેનાં ગલુડિયાં સાથે આવી.  
 (C) ભાવનગરથી અંબાજી ઘણું દૂર છે. (D) સમીરે તેને ગુલાબ આપ્યું.
- (79) શબ્દાર્થની ખોટી જોડ હોય તેવો કયો વિકલ્પ છે ?  
 (A) રબીશ - અર્થહીન (B) હિચકારું - હીન કોટિનું  
 (C) અજંપો - કુદાર (D) આશ્લેષ - ભેટવું
- (80) ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય કયું છે ?  
 (A) ગોપાલભાઈ સજ્જન વ્યક્તિ છે.  
 (B) વિદ્યાર્થીનું એક માત્ર લક્ષ હોય છે - ઉત્તમ અભ્યાસ.  
 (C) આ ટીશર્ટની શી કિંમત છે ?  
 (D) ઓફિસમાં સફાઈકામ કરતા કર્મચારીઓ એકઠા થવાના છે.
- (81) 'મંદિરની આગળ એક નાનકડો બગીચો છે.' - વાક્યમાં વપરાયેલ નામયોગી ઓળખો.  
 (A) મંદિર (B) ની (C) આગળ (D) બગીચો

- (82) 'તુંબડીમાં કાંકરા હોવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?  
 (A) કશી જ સમજ ન પડવી (B) નુકશાનમાં વધુ નુકસાન  
 (C) ભેદભાવ હોવો (D) વજૂદ વિનાનું હોવું
- (83) સંધિની કઈ જોડ ખોટી છે ?  
 (A) કલા + ઊર્મિ = કલોર્મિ (B) નવ + ઓઢા = નવોઢા  
 (C) અનુ + એષણા = અન્વેષણા (D) વાકૂ + આડંબર = વાગાડંબર
- (84) વિરામચિહ્નોનો ઉચિત પ્રયોગ ન થયો હોય તેવું વાક્ય કયું છે ?  
 (A) એણે કહ્યું : હું ત્યાં ક્યારેય આવીશ નહીં.  
 (B) મા'રાજ, આ માટે શું જોઈશે ?  
 (C) બધાં જ તત્ત્વજ્ઞાન (?) સમજી શકતા હશે ?  
 (D) "બોલે એનાં બોર વેચાય"
- (85) ખોટી જોડણી કયા શબ્દની છે ?  
 (A) કમિશનર (B) ઉતુંગ (C) કમિટી (D) નૈર્ઝત્ય
- (86) Find the different word from following words.  
 (A) retrieve (B) rescue (C) salvage (D) evade
- (87) Neither you nor your friend was sick ..... ?  
 (Put a suitable question tag choosing from the given options below.)  
 (A) Wasn't he ? (B) Was he ? (C) Weren't they ? (D) Were they ?
- (88) If Mr. Shah had saved money earlier, he ..... a new car.  
 (A) bought (B) have had bought  
 (C) will have bought (D) would have bought
- (89) Shruti said to Neha, "You are my best friend now." - find correct indirect speech.  
 (A) Shruti told Neha the she was her best friend then.  
 (B) Shruti told Neha that she was her best friend now.  
 (C) Shruti told Neha that she was her best friend then.  
 (D) Shruti said Neha that she is her best friend then.
- (90) The lightning has a tongue of flame. Identify the figure of speech used in the sentence.  
 (A) Irony (B) Personification  
 (C) Metaphor (D) Simile
- (91) Dr. Harris welcomed the members of the committee and went on ..... the subject of the meeting.  
 Put Proper verb form.  
 (A) introduced (B) introducing  
 (C) introduces (D) to introduce

- (92) Find out similar word for : Assault  
 (A) Defence (B) Beating (C) Shooting (D) Attack
- (93) Select the correct sentence.  
 (A) Unless you worked hard, you will fail.  
 (B) Unless you don't work hard, you will fail.  
 (C) Unless you work hard, you will fail.  
 (D) Unless you will work hard, you will fail.
- (94) Intelligent ..... he is, he could not pass that exam.  
 (A) though (B) however (C) yet (D) as
- (95) Parth filled ten litres of petrol to go to Ahmedabad. Select the most appropriate option to get the underlined word as answer.  
 (A) How much petrol Parth filled to go to Ahmedabad ?  
 (B) How much petrol did Parth filled to go to Ahmedabad ?  
 (C) How much petrol did Parth fill to go to Ahmedabad ?  
 (D) How much petrol Parth fill to go to Ahmedabad ?
- (96) Let her kill the mouse. Select the correct passive sentence.  
 (A) The mouse was killed by her.  
 (B) Let the mouse be killed by her.  
 (C) Let the mouse is killed by her.  
 (D) Let her kill the mouse.
- (97) No sooner did I reach the college .....  
 (Select correct option to complete the sentence)  
 (A) when it started to rain. (B) and it started to rain.  
 (C) than it started to rain. (D) after it started to rain.
- (98) Neither of your friend will come. Identify the Pronoun.  
 (A) Distributive (B) Demonstrative  
 (C) Indefinite (D) Reciprocal
- (99) Many times he helps those ..... he doesn't know.  
 (A) who (B) which (C) what (D) whom
- (100) If you ..... the rumour, you .....  
 (A) had spread, would have been arrested.  
 (B) had spread, would have arrested  
 (C) had spreaded, would have been arrested  
 (D) had spreaded, could have arrested

- (101) બટાટાનો બંગડીરોગ કયા રોગ પ્રેરકથી થાય છે ?  
 (A) જવાણુથી (B) વાયરસથી (C) ફૂગથી (D) કૃમિથી
- (102) “સંકલિત ગ્રામ વિકાસ યોજના”ની શરૂઆત કઈ સાલમાં થઈ ?  
 (A) 1994 (B) 1982 (C) 1980 (D) 1969
- (103) બાજરીનો કુતુલ રોગ કયારોગ પ્રેરકથી થાય છે ?  
 (A) વિષાણુથી (B) જવાણુથી (C) ફૂગથી (D) કૃમિથી
- (104) ટમેટીમાં એક હેક્ટરની રોપણી માટે કેટલા ગ્રામ બીજનું ધરૂવાડિયું બનાવવું જોઈએ ?  
 (A) 500 ગ્રામ (B) 300 ગ્રામ (C) 1200 ગ્રામ (D) 800 ગ્રામ
- (105) નીચેનામાંથી કયુ ઓજાર પ્રાથમિક ખેડ માટે ઉપયોગી નથી ?  
 (A) લોખંડનું હળ (B) ચાવડ (C) કરબ (D) કળિયું
- (106) હવામાં ભેજનું પ્રમાણ જાણવા માટે કયું સાધન ઉપયોગી છે ?  
 (A) હાઈગ્રોમિટર (B) હાઈગ્રોમિટર (C) એનિમોમિટર (D) રેઈનગેજ
- (107) ટ્રેક્ટરની ઉપયોગિતા પ્રમાણે મુખ્યત્વે કેટલા પ્રકાર છે ?  
 (A) ચાર (B) બે (C) પાંચ (D) છ
- (108) સિંગલ સુપર ફોસ્ફેટ રાસાયણિક ખાતરમાં કેટલા ટકા ફોસ્ફરસ તત્વ હોય છે ?  
 (A) 20 ટકા (B) 46 ટકા (C) 16 ટકા (D) 21 ટકા
- (109) શેરડીના પાકને કેવું હવામાન અનુકૂળ આવે છે ?  
 (A) સૂકુ અને ઠંડુ (B) ગરમ અને ભેજવાળું  
 (C) માત્ર સૂકુ (D) માત્ર ગરમ
- (110) વિશ્વમાં દિવેલાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે ?  
 (A) 48 ટકા (B) 52 ટકા (C) 32 ટકા (D) 38 ટકા
- (111) કટકા કલમ માટે કટકાની લંબાઈ કેટલા સે.મી. રાખવી જોઈએ ?  
 (A) 30 સે.મી. (B) 20 સે.મી. (C) 10 સે.મી. (D) 15 સે.મી.
- (112) ગુટીકલમ કયા ફળઝાડમાં વધારે સફળ થાય છે ?  
 (A) આંબો (B) બોરડી (C) કેળ (D) લીંબુડી
- (113) મરચીના પાકનું મૂળવતન જણાવો.  
 (A) ભારત (B) ઈઝરાઈલ (C) અમેરિકા (D) જાપાન

- (114) નીચેનામાંથી કયું કીટક બહુભોજી કીટક છે ?  
 (A) કમાસીયા (B) મોલોમશી (C) ઘોડિયા ઈયળ (D) પાયરીલા
- (115) નાળીયેરના પાણીમાં કયો હોર્મોન્સ હોય છે ?  
 (A) સાયટોકાયનીન (B) જબ્રેલીન (C) અલાર (D) ઓક્ઝીન
- (116) કયું ફળ અતિ પ્રાચીન અને સામાન્ય ફળ છે ?  
 (A) મોસંબી (B) બોર (C) પપૈયા (D) સફરજન
- (117) જૂનાગઢ ઘોલર કયા પાકની સુધારેલી જાત છે ?  
 (A) બાજરી (B) દિવેલા (C) ટામેટી (D) મરચી
- (118) ચરપાળા બનાવવા માટે નીચેનામાંથી કયું સાધન વપરાય છે ?  
 (A) લાકડાનું હળ (B) સમાર (C) રપટ (D) રીઝર
- (119) સ્ટેનર (જાળી) કોનો ભાગ છે ?  
 (A) ઈમ્પેલરનો (B) આવકનળીનો  
 (C) ફુટવાલ્વનો (D) જાવકનળીનો
- (120) સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?  
 (A) ફેબ્રુ - 17 (B) 1-1-96 (C) 2-10-1980 (D) 1991
- (121) ખારેક પાકમાં કઈ બહાર લેવામાં આવે છે ?  
 (A) હસ્તબહાર (B) મૃગ બહાર (C) આંબે બહાર (D) એકેય નહીં
- (122) કયા ફુલને શોભા, પ્રેમ અને સદ્ભાવનાનું પ્રતિક ગણવામાં આવે છે ?  
 (A) લીલી (B) ગુલાલ (C) કમળ (D) કરેણ
- (123) જીવનધારા યોજના ક્યારથી સ્વતંત્ર કરવામાં આવી ?  
 (A) ફેબ્રુ - 1997 (B) 1-1-1996 (C) 1980 (D) માર્ચ - 1980
- (124) ખપેડી કીટક કયા પાકમાં નુકશાનક કરે છે ?  
 (A) ડાંગર (B) મકાઈ (C) જુવાર (D) બાજરી
- (125) ગુજરાત કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર પર જે તે પાકના નિષ્ણાત દ્વારા કયુ બીજ તૈયાર કરવામાં આવે છે ?  
 (A) બ્રીડર (B) ન્યુકિલિયસ (C) ફાઉન્ડેશન (D) કોમર્શિયલ
- (126) કોબી-ફલાવરના પાકને સામાન્ય રીતે કેવું હવામાન વધું અનુકૂળ આવે છે ?  
 (A) ગરમ (B) ગરમ અને ભેજવાળું  
 (C) ઠંડું અને સૂકું (D) વરસાદવાળું

- (127) નીચેનામાંથી કઈ ઔષધિય વનસ્પતિ સૌંદર્ય પ્રસાધનોમાં ખૂબ ઉપયોગી છે ?  
 (A) ગૂગળ (B) સોનામુખી (C) અશ્વગંધા (D) કુંવારપાહું
- (128) ગુજરાતના કયા વિસ્તારમાં લીલીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે ?  
 (A) ઉત્તર ગુજરાત (B) દક્ષિણ ગુજરાત (C) મધ્ય ગુજરાત (D) સૌરાષ્ટ્ર
- (129) ભારતની પ્રથમ પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપ્યું હતું ?  
 (A) શિક્ષણ (B) ઔદ્યોગિક વિકાસ  
 (C) રાષ્ટ્રીય સંરક્ષણ (D) કૃષિ-વિકાસ
- (130) સરકારે ગણોતિયાઓના હિત માટે કઈ બેન્કની સ્થાપના કરી હતી ?  
 (A) ડીસ્ટ્રિક્ટ બેન્ક (B) નાગરિક બેન્ક  
 (C) જમીન વિકાસ બેન્ક (D) મધ્યસ્થ જિલ્લા સહકારી બેન્ક
- (131) શેરડીનો રસ કાઢી તેને રિફ્રેક્ટોમિટરમાં જોતાં કેટલાથી વધુ આંક બતાવે તો શેરડી પરિપક્વ થયેલી કહી શકાય ?  
 (A) 18 (B) 28 (C) 19 (D) 29
- (132) જળપૂરણની ક્રિયામાં શું કરવામાં આવે છે ?  
 (A) પંખા તથા જાવકનળીમાં પાણી ભરવામાં આવે છે.  
 (B) આવકનળીમાં તેલ રેડવામાં આવે છે.  
 (C) આવકનળી તથા પંખા સુધી પાણી ભરવામાં આવે છે.  
 (D) આવકનળીમાં હવા ભરવામાં આવે છે.
- (133) જાપાનમાં સેવંતીની કેટલી જાતો નોંધાયેલી છે ?  
 (A) 5000 થી વધુ (B) 4000 (C) 3000 થી વધુ (D) 2000
- (134) ખેતર પર એક કરાતાં વધારે વ્યવસાયમાંથી કુલ આવકના 50% કે તેથી વધારે આવક થાય તેવી ખેતીને શું કહેવાય ?  
 (A) એકપાકી (વિશિષ્ટ) ખેતી (B) સામાન્ય પાકની (મિશ્ર) ખેતી  
 (C) ઘનિષ્ટ ખેતી (D) વિસ્તૃત ખેતી
- (135) લઘુત્તમ અને ગુરુત્તમ થરમોમિટરમાં કાયની નળી કેવા આકારની હોય છે ?  
 (A) V આકાર (B) U આકાર (C) J આકાર (D) I આકાર
- (136) રીંગણીમાં થતો કોકડવા રોગ કયા રોગપ્રેરકથી થાય છે ?  
 (A) બેક્ટેરીયા (B) વાયરસ (C) ફૂગ (D) કૃમિ
- (137) કોબી, ફલાવરના મહત્તમ ઉત્પાદન માટે જમીનનો P.H. આંક કેટલો હોવો જોઈએ ?  
 (A) 6.6 થી 7 (B) 7 થી 8 (C) 4.5 થી 5.5 (D) 5.5 થી 6.6



- (138) એક હેક્ટર ટમેટીના વાવેતર માટે કેટલું બિયારણ જોઈએ ?  
 (A) 5 કિલો (B) 4 કિલો (C) 100 ગ્રામ (D) 800 ગ્રામ
- (139) વનસ્પતિ ઓક્સિજન તત્વ ક્યાંથી મેળવે છે ?  
 (A) પાણીમાંથી (B) હવામાંથી (C) જમીનમાંથી (D) કાર્બન તત્વમાંથી
- (140) ઢાળવાળી જમીનમાં કયા પાક વાવવાથી જમીનનું ધોવાણ ઓછું થાય છે ?  
 (A) સોટી મૂળવાળા પાકો (B) વેલાવાળા પાકો (C) તંતુ મૂળવાળા પાકો (D) લસણ-ડુંગળીનો પાક
- (141) કયા ધોવાણને જમીનના ક્ષય સમાન ગણવામાં આવે છે ?  
 (A) ચીરા રૂપે થતું ધોવાણ (B) કોતરરૂપે થતું ધોવાણ  
 (C) પાણીથી થતું ધોવાણ (D) ચાદરપટ ધોવાણ
- (142) કોન્ટુર પાળા બાંધવાનું ખેડૂતો કેમ પસંદ કરતા નથી ?  
 (A) કોન્ટુર પાળા તુટતા નથી. (B) પાળા તુટવાથી ખેડૂતને ઘણું નુકશાન થાય છે.  
 (C) ખેતરમાં પાણી ભરાતું નથી. (D) કોન્ટુર પાળા બાંધવામાં ખામી રહેતી નથી.
- (143) મિશ્ર પાક એટલે શું ?  
 (A) મુખ્ય પાકની સાથે બીજા પાકનું વાવેતર કરવું. (B) એક જ પાક લેવાની પદ્ધતિ  
 (C) જમીન-પડતર-વાસલ રાખવાની પદ્ધતિ. (D) ત્રણ ઋતુમાં એક જ પાક લેવો.
- (144) સારા બીજનું એક લક્ષણ જણાવો ?  
 (A) બીજ ડંખવાળું હોવું જોઈએ. (B) બીજમાં આનુંવંશિક શુદ્ધતા હોવી ખાસ જરૂરી છે.  
 (C) બીજ 50% કરતાં વધારે ઉગવા જોઈએ. (D) સ્ફૂરણ શક્તિ નબળી હોવી જોઈએ.
- (145) સારા કહોવાયેલા છાણિયા ખાતરમાં નાઈટ્રોજન કેટલા ટકા હોય છે ?  
 (A) 0.8% નાઈટ્રોજન (B) 0.03% નાઈટ્રોજન  
 (C) 10% નાઈટ્રોજન (D) 0.50% થી 0.80% નાઈટ્રોજન
- (146) એક અળસિયું દિવસ દરમિયાન કેટલી વખત જમીન ઉપર આવે છે અને એક દિવસમાં કેટલા કાણાં જમીનમાં પાડે છે ?  
 (A) એક વખત જમીન ઉપર આવે છે અને એક કાણું પાડે છે.  
 (B) 3 થી 4 વખત જમીન ઉપર આવે છે અને 6 થી 8 કાણાં પાડે છે.  
 (C) 8 થી 10 વખત જમીન ઉપર આવે અને 16 થી 20 કાણાં પાડે છે.  
 (D) 18 થી 30 વખત જમીન ઉપર આવે અને 25 થી 30 કાણાં પાડે છે ?
- (147) યુરિયા અને એમોનિયમ સલ્ફેટમાં નાઈટ્રોજન કેટલા ટકા હોય છે ?  
 (A) 40% અને 20% નાઈટ્રોજન (B) 46% અને 20.6% નાઈટ્રોજન  
 (C) 16.0% અને 44% નાઈટ્રોજન (D) 15% અને 20% નાઈટ્રોજન

- (148) ભૂકી સ્વરૂપે દવા છાંટવાના પંપને કયા નામથી ઓળખવામાં આવે છે ?
- (A) સેન્ટ્રી ફ્યુગલ પંપ (B) નેપસેક સ્પ્રેયર પંપ  
(C) સધન ડસ્ટર પંપ (D) પગથી ચાલતા સ્પ્રેયર પંપ
- (149) નર્મદા યોજના એ અમેરિકાના ગ્રાન્ડકૂલી બંધ પછીનો દુનિયાનો કેટલામાં નંબરનો બંધ છે ?
- (A) 4 નંબરનો (B) 3 નંબરનો  
(C) 2 નંબરનો (D) 6 નંબરનો
- (150) કઈ પિયત પદ્ધતિ વાપરવાથી રેતાળ જમીનમાં ધોવાણ થતું નથી ?
- (A) રેળ લફેળ પદ્ધતિ (B) ક્યારા પદ્ધતિ  
(C) નીક પાળા પદ્ધતિ (D) ફૂવારા પિયત પદ્ધતિ વાપરવાથી
- (151) કઈ વન ઔષધીયના મૂળ અનિદ્રામાં ઉપયોગી છે ?
- (A) સફેદ મુસળી (B) અશ્વગંધા વનસ્પતિ  
(C) કાલમેઘ કરિયાતું (D) નાગરવેલના મૂળ
- (152) આંબાના કાલવ્રણ (એન્થ્રેકનોઝ) કૂમળાં પાન પર અનિયમિત આકારના નાના 2 બઠાં પડે છે એનું એક ઉદાહરણ આપો.
- (A) મધ જેવો ચિકણો પદાર્થ ઝરે છે ? (B) પાન કોકડાઈ જાય છે ?  
(C) પાનની કિનારી કાળી થઈ સુકાઈ જાય છે ? (D) પાન પીળા પડી જાય છે.
- (153) કયા ફળમાંથી ટૂટી-ફૂટી બનાવવામાં આવે છે ?
- (A) જામફળ (B) સીતાફળ (C) દાડમ (D) પપૈયાં
- (154) વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચિકિત્સા પદ્ધતિમાં કેટલી ઔષધિય વનસ્પતિઓની યાદી બનાવેલ છે ?
- (A) 20,000 (B) 30,000 (C) 10,000 (D) 2,000
- (155) ચાવીને ખાનારાં કિટકોના નિયંત્રણ માટે કયા પ્રકારના વિષ (ઝેર) વપરાય છે ?
- (A) સ્પર્શ વિષ (B) જઠર વિષ (C) ધૂમકર વિષ (D) ભૌતિક વિષ
- (156) નીચેનામાંથી કયા ફળને “ગરીબોના મેવા” તરીકે ઓળખવામાં આવે છે ?
- (A) સીતાફળ (B) બોર (C) જામફળ (D) સફરજન
- (157) નીચેનામાંથી કયો ફળપાક આદર્શ ખોરાક ગણાય છે ?
- (A) ચીકુ (B) પપૈયાં (C) કેરી (D) કેળા
- (158) આંબાનું વૈજ્ઞાનિક નામ શું છે ?
- (A) અબોન (B) મુસાસ્ય  
(C) મેન્જીફેરા ઈન્ડિકા (D) ક્લોરોફાયરમ્

- (159) સજીવ ખેતીનું વિશ્વ વિદ્યાલય કયું છે ?  
 (A) જંગલો (B) કુદરત (C) કૃષિ યુનિવર્સિટી (D) જમીન
- (160) નીચેનામાંથી જેલી બનાવવા માટે કયા ફળનો ઉપયોગ થાય છે ?  
 (A) ચીકુ (B) પપૈયાં (C) કેળા (D) જમરૂખ
- (161) વૈજ્ઞાનિકોના મત મુજબ આ સૃષ્ટિ પર કિટકની કેટલા લાખથી વધારે પ્રજાતિઓ છે ?  
 (A) 10 લાખ (B) 9 લાખ (C) 2 લાખ (D) 5 લાખ
- (162) જમીનની ઉત્પાદન શક્તિ પર નીચેનામાંથી કયું એક મહત્વનું નિયંત્રિત પરિબલ છે ?  
 (A) આબોહવા (B) ભેજ (C) નિતાર (D) પવન
- (163) એક વ્યક્તિએ સતત કેટલા કલાકથી વધારે સમય દવા છાંટવી નહિ ?  
 (A) 6 કલાક (B) 10 કલાક (C) 4 કલાક (D) 8 કલાક
- (164) વિસ્તરણ કાર્યકર અને ખેડૂતોનો સમય કયા કાર્યક્રમથી બચે છે ?  
 (A) વ્યક્તિ સંપર્ક (B) રેડિયો, T.V. કાર્યક્રમ  
 (C) પ્રવાસ-પર્યટન (D) સાહિત્ય
- (165) કુદરતી બળોના 2.5 સે.મી. જમીનનો થર તૈયાર થતાં કેટલા વર્ષ લાગે છે ?  
 (A) 800 થી 1000 વર્ષ (B) 1200 થી 1400 વર્ષ  
 (C) 600 થી 800 વર્ષ (D) 300 થી 400 વર્ષ
- (166) મકાઈના પાકનું વિશિષ્ટ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?  
 (A) નવસારી (B) જૂનાગઢ (C) ડીસા (D) ગોધરા
- (167) કયા દેશની માફક વરસાદનું એક-એક ટીપું બચાવવું એ આપણી ફરજ છે ?  
 (A) અમેરિકા (B) જર્મની (C) ઈઝરાયલ (D) ચીન
- (168) કાળમીઠ ખડકમાંથી બનેલી જમીન કેવી હોય છે ?  
 (A) ફળદ્રુપ (B) હલકી (C) ચીકણી (D) ગોરાડું
- (169) હરિયાણી ક્રાંતિના જનક કોને કહેવામાં આવે છે ?  
 (A) ડૉ. સ્વામીનાથન (B) એરિસ્ટોટલ  
 (C) આર્કિમિડીઝ (D) ડાર્વિન
- (170) આળસિયું માટીખાઈને મળસ્વરૂપે બહાર કાઢે છે તેને શું કહે છે ?  
 (A) વર્મીકલ્યર (B) વર્મીકમ્પોસ્ટ  
 (C) કાર્સ્ટિંગ (D) સેન્દ્રિય ખાતર

- (171) ડી.એ.પી. ખાતરમાં કેટલા ટકા નાઈટ્રોજન હોય છે ?  
 (A) 18% (B) 15% (C) 22% (D) 27%
- (172) કઠોળવર્ગના પાકને હવામાંના નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં કયું તત્ત્વ ખૂબ જ ઉપયોગી છે ?  
 (A) મોલીબ્ડેડમ (B) જસત (C) બોરોન (D) તાંબુ
- (173) રાજકોટ જિલ્લાનું કયું કેન્દ્ર સૂકીખેતીના સંશોધનનું મુખ્ય મથક છે ?  
 (A) ધારી (B) રાતીયા (C) વલ્લભીપુર (D) તરઘડિયા
- (174) એલોવેરા કયા ઔષધિય પાકની સુધારેલી જાત છે ?  
 (A) ગુગળ (B) અશ્વગંધા (C) કુંવારપાઠું (D) મીઠી આવળ
- (175) કયા ફળને ભારતનું રાષ્ટ્રીય ફળ ગણવામાં આવે છે ?  
 (A) પપૈયું (B) કેરી (C) સફરજન (D) ચીકુ
- (176) તુલસીના પાનમાં કયુ રસાયણીક તત્ત્વ રહેલું છે ?  
 (A) મિથાઈલ યુજેનોલ (B) ફોસ્ફોમીડોન (C) વારફરીન (D) કાર્બોરિલ
- (177) કેળના પાકને કેવું હવામાન અનુકૂળ છે ?  
 (A) ઠંડું (B) સૂકું  
 (C) ગરમ અને ભેજવાળું (D) સમઘાત
- (178) પપૈયાનું મૂળવતન કયું છે ?  
 (A) ભારત (B) અમેરિકા (C) આફ્રિકા (D) એકપણ નહીં
- (179) મ્યુટેશનથી પપૈયાની કઈ જાત વિકસવામાં આવી ?  
 (A) વોશિંગ્ટન (B) પુસા મેજેસ્ટી (C) સોલો સનરાઈઝ (D) પુસા નન્દા
- (180) અળસિયા ઉછેર માટે બેડની ઉંચાઈ કેટલી રાખવામાં આવે છે ?  
 (A) 20 ફુટ (B) 3 ફુટ (C) 1.50 ફુટ (D) 1.25 ફુટ
- (181) ખેડૂત પાસે કેટલી કિંમતના જુદાં-જુદાં સાધનો છે તેનો ખ્યાલ કયા પત્રક ઉપરથી તમને આવશે ?  
 (A) માલસ્ટોક પત્રક (B) પાક - ઉત્પાદન પત્રક  
 (C) રોજમેળ (D) ડેડસ્ટોક પત્રક
- (182) મેળવેલા જ્ઞાનનો તદ્દન નૂતન અને નિશ્ચિત કે અનિશ્ચિત પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની શક્તિ-સામર્થ્ય કે ક્ષમતાને શું કહે છે ?  
 (A) ઉપયોજન (B) જ્ઞાનની સમજ  
 (C) વિશ્લેષણ (D) સંશ્લેષણ

- (183) ખેડૂતને દેશી ગોટલાના આંબાના છોડ પર કઈ કલમ કરવાની સલાહ આપશો ?
- (A) ગુટીકલમ (B) દાબકલમ  
(C) નૂતનકલમ (D) ઢગલાદાબ કલમ
- (184) વિસ્તરણ શિક્ષણની પદ્ધતિઓ કેટલી છે ?
- (A) ચાર (B) આઠ  
(C) ત્રણ (D) પાંચ
- (185) વર્ગખંડમાં એક તાસ દરમિયાન જે મુદ્દો શીખવવાનો છે તેના માટે શિક્ષક પાસે મુખ્ય કઈ પૂર્વ તૈયારી હોવી જોઈએ ?
- (A) પાઠ્ય પુસ્તક (B) મૂલ્યાંકન કસોટી  
(C) સંદર્ભ પુસ્તક (D) આયોજન
- (186) હવામાનનું દબાણ જાણવાનું સાધન વિદ્યાર્થીઓને બતાવવું છે તો તમે કયું સાધન બતાવશો ?
- (A) ઉષ્ણતામાન (B) બેરોમીટર  
(C) બેરોગ્રાફ (D) હાઈગ્રોમીટર
- (187) શિક્ષકે વર્ગખંડમાં વિષયાભિમુખ કૌશલ્ય હસ્તગત કરવા માટે કયા પ્રકારનું અનિચ્છનીય વર્તન કરવાનું ટાળવું જોઈએ ?
- (A) કડક વલણ (B) સાહજિકતા પૂર્વકનું વર્તન  
(C) હાસ્ય પૂર્વકનું વર્તન (D) સાતત્યભંગનું વર્તન
- (188) કસોટીની રચના માટે ત્રિપરિમાણદર્શક કોષ્ટક (Blue Print) ની રચના શાના આધારે કરવામાં આવે છે ?
- (A) હેતુઓ આધારિત ગુણભાર નક્કી કરવો.  
(B) વિષયવસ્તુ આધારિત ગુણભાર નક્કી કરવો  
(C) પ્રશ્નના પ્રકાર આધારિત ગુણભાર નક્કી કરવો.  
(D) ઉપરોક્ત ત્રણેય બાબતોને ધ્યાનમાં લઈને ત્રિપરિમાણ દર્શક કોષ્ટક રચવું.
- (189) ઉપચારાત્મક કાર્યમાં વિદ્યાર્થીઓની ભૂલોનો ઉપચાર કરવામાં આવે છે.
- (A) સાચું (B) ખોટું  
(C) અંશત: સાચું (D) અંશત: ખોટું
- (190) રજૂ થયેલા ઉદાહરણોના અભ્યાસથી વિદ્યાર્થીઓ જે સિદ્ધાંત તારવે તેને કઈ પદ્ધતિ કહેવાય છે ?
- (A) અર્થબોધ પદ્ધતિ (B) નિગમન પદ્ધતિ  
(C) આગમન પદ્ધતિ (D) પ્રત્યક્ષ પદ્ધતિ
- (191) પ્રત્યક્ષ પદ્ધતિ અન્ય કયા નામે ઓળખાય છે.
- (A) અર્થબોધ પદ્ધતિ (B) પરોક્ષ પદ્ધતિ  
(C) આગમન પદ્ધતિ (D) પ્રાકૃતિક પદ્ધતિ

- (192) કૃષિ વિદ્યા અંતર્ગત સજીવ ખેતી એટલે શું ?  
 (A) સજીવ ખેતીમાં કૃત્રિમ રસાયણોનો ઉપયોગ અલ્પ પ્રમાણમાં હોય છે.  
 (B) વધારે પડતા રાસાયણિક ખાતરો વાપરવા.  
 (C) છાણિયુ ખાતર વાપરવું નહીં.  
 (D) વરસાદ આધારીત ખેતી.
- (193) નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિ એ અધ્યેતાકેન્દ્રી શિક્ષણ પદ્ધતિ નથી ?  
 (A) પ્રોજેક્ટ પદ્ધતિ (B) પ્રયોગ પદ્ધતિ  
 (C) વ્યાખ્યાન પદ્ધતિ (D) જૂથ ચર્ચા પદ્ધતિ
- (194) વ્યાખ્યાન પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય કરાવવાથી શો ફાયદો થાય છે ?  
 (A) તે શિક્ષક કેન્દ્રી હોવાથી વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે આંતરક્રિયા સંભવિત નથી.  
 (B) માહિતી પ્રધાન એકમો વાળો લાંબો અભ્યાસક્રમ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકાય છે.  
 (C) વિદ્યાર્થી નિષ્ક્રિય શ્રોતા બની રહે છે.  
 (D) વિદ્યાર્થીઓની વિષયવસ્તુને ગોખવાની વૃત્તિ પ્રબળ બને છે.
- (195) ભારત સરકારે ગંગા કલ્યાણ યોજના કઈ સાલમાં અમલમાં મુકવાનું નીક્ક કર્યું હતું ?  
 (A) ફેબ્રુઆરી 1992 (B) ફેબ્રુઆરી 1990  
 (C) ફેબ્રુઆરી 1995 (D) ફેબ્રુઆરી 1997
- (196) ખેડૂતમાં શિક્ષણનો અભાવ હોય તો...  
 (A) ખેતરનું ક્ષેત્રફળ ઘટે (B) ખેત ઉત્પાદન ઘટે  
 (C) ખેડૂતને લોન ન મળે (D) કોઈ અસર ન થાય
- (197) કૃષિવિદ્યાના શિક્ષણ માટે વધુ યોગ્ય શું છે ?  
 (A) વર્ગખંડ શિક્ષણ (B) પ્રયોગ શાળામાં શિક્ષણ  
 (C) ખેતરોની મૂલાકાત (D) ટેલીવિઝન ઉપર કાર્યક્રમો જોવા
- (198) નીચેના પૈકી કયા કાર્યને પ્રાયોગિક કાર્ય કહેવાય ?  
 (A) નજીકના બીજકેન્દ્રની મુલાકાત લેવી (B) સારીજાતનાં બીજ એકઠા કરવા  
 (C) ક્યારા અને કુંડામાં રોપ તૈયાર કરવો (D) દર્શાવેલ ત્રણેય
- (199) ઉપચારાત્મક કાર્યમાં વિદ્યાર્થીઓની ભૂલોનો ઉપચાર કરવામાં આવે છે. આ વિધાન.....  
 (A) સાચું (B) ખોટું (C) અંશત: સાચું (D) અંશત: ખોટું
- (200) શૈક્ષણિક સાધનોના પ્રકાર કયા છે ?  
 (A) દૃશ્ય (B) દ્રાવ્ય (C) દૃષ્ય-શ્રાવ્ય (D) ઉપરના ત્રણેય



રફ કામ માટેનું પેઈજ

રફ કામ માટેનું પેઈજ

પરીક્ષા પૂરી થયા બાદ ઉત્તરપત્ર (OMR SHEET) ખંડ નિરીક્ષકને ખુલ્લું (કવરમાં મુક્યા વગર) પરત કર્યા બાદ જ પરીક્ષા ખંડ છોડવાનો રહેશે. તેમ કરવામાં કસૂર થયેથી શિસ્તભંગના પગલાં ગણી પરીક્ષા માટે જે તે ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે.